

B.A Semester - 3 (NEP-2020) Examination

OCT/NOV-2025

Home Sci.: Health & Beauty -1 (Skill Enhancement Course)

Time: 1:00 Hours

Marks:25

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ વસ્ત્ર અને આભૂષણની પસંદગીના મુદ્દાઓ સવિસ્તાર સમજાવો. (૧૦)
અથવા

પ્રશ્ન-૧ વજન એટલે શું ? વજન ઘટાડવાના ઉપાયો.

પ્રશ્ન-૨ માનસિક તંદુરસ્તી એટલે શું ધ્યાન વિશે જણાવો. (૧૦)
અથવા

પ્રશ્ન-૨ વિટામીન અને તેના ફાયદાઓના મુદ્દાઓ સવિસ્તાર જણાવો.

પ્રશ્ન-૩ ટ્રેકનોંધ લખો: (કોઈ પણ એક) (૦૫)
1) જૂતાની પસંદગી સવિસ્તાર સમજાવો.
2) સૌંદર્ય- વ્યક્તિત્વનો એક ભાગ સમજાવો.

ENGLISH VERSION

Que.1 Explain in detail the points of choice of clothing and ornament. (10)
OR

Que.1 What is weight? Explain the suggestion for in decrease the Weight.

Que.2 What is mental health? and explain in detail about meditation. (10)
OR

Que.2 Explain in detail the points of vitamins and their benefits.

Que.3 Write a short note (any one) (05)
1) Explain shoes selection in detail.
2) Beauty- Explain a part of personality.
